

શુલ્કનું સમયપત્રક ઇક્વિટાસ પ્રિફર્ડ સેલરી એકાઉન્ટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)



સંરેરાશ માસિક બેલેન્સ (AMB)	
સંરેરાશ માસિક બેલેન્સ (AMB)	શૂન્ય
AMB બન-જાળવણી શુલ્ક	શૂન્ય
ડેબિટ કાર્ડ	
ડેબિટ કાર્ડ** પ્રકાર	રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ
ડેબિટ કાર્ડ જારી અને ફરી જારી ક્ષયાના શુલ્ક	મફત
વાર્ષિક જાળવણી અને નવીકરણ શુલ્ક	મફત
ઉધરાણી	
સ્થાનિક ચેક ક્રિયાર્થિ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	૫૦૦૦ રૂપિયા સુધીના શુલ્ક રૂ.૨૫, ૫૦૦૦ થી વધુ અને રૂ.૧૦,૦૦૦ સુધીના શુલ્ક રૂ.૫૦/-, રૂ.૧૦,૦૦૦ થી વધુ અને રૂ.૧૦૦૦૦૦ સુધીના શુલ્ક રૂ.૧૦૦/-, રૂ.૧૦૦૦૦૦ થી વધુના શુલ્ક રૂ.૧૫૦/- અમલમાં
બેંક સિવાયના અન્ય સ્થાનોએ અન્ય બેંક ચેક ક્રેડિટશનનું શુલ્ક	
RTGS ઇનવર્ડ/NEFT ઇનવર્ડ/IMPS ઇનવર્ડ	મફત
ગ્રોસ ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુકવણી	
ઇક્વિટાસ બેંકની શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	ESFB સ્થાને જારી થયેલ ત્રિમાસમાં ૧૫ ડીડી સુધી મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ ડીડી રૂ. ૫૦
ઇક્વિટાસ બેંકની શાખા સિવાયના સ્થાનોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	પ્રતિ ડીડી રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખાએ RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઇન)	NEFT: રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨.૨૫, રૂ. ૧૦૦૦૧ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫, RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (દિવસ દીઠ મર્યાદા ૫,૦૦,૦૦૦/-)	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ. ૨.૫/-, રૂ. ૫૦૦૦૦૦- રૂ. ૧ લાખ: રૂ. ૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ. ૭.૫/-
ચેક બુક	દર ત્રણ મહિને ૧૫ લીફ મફત
મુક્ત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ લીફ રૂ. ૩૫
રોકડ શુલ્ક	
સંચુકત રોકડ જમાની મર્યાદા (રહેઠાણ અને બિન-રહેઠાણ)	૫૦૦,૦૦૦ રૂપિયા સુધી ૧૦ વ્યવહારો મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	રૂ. ૫/૧૦૦૦
સંચુકત રોકડ ઉપાડની મર્યાદા (રહેઠાણ અને બિન-રહેઠાણ)	મફત અમર્યાદિત
ઇક્વિટાસ એટીએમ પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય) ફક્ત ચિમીભય તથા	મફત અમર્યાદિત
અન્ય એટીએમ પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહારો (મેટ્રો/શહેરી/અર્ધ-શહેરી/ગ્રામીણ સ્થાન અન્ય એટીએમ) (નાણાકીય અને બિન-નાણાકીય)	૫
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ નાણાકીય વ્યવહાર રૂ. ૨૩/-, ૧૨ રૂપિયા પ્રતિ બિન-નાણાકીય વ્યવહાર
નોન-ઇક્વિટાસ એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નક્કરું	રૂ. ૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોકડ ઉપાડ	રૂ. ૧૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ	રૂ. ૨૫ પ્રતિ વ્યવહાર
અન્ય શુલ્ક	
એટીએમ ઉપાડની મર્યાદા	૨૦૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ
પીઓએસ / ઇ-ગ્રોમર્સ મર્યાદા	૩૦૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ
કાર્ડ વડે વ્યવહારની સ્લિપની પુનઃપ્રાપ્તિના શુલ્ક	રૂ. ૨૫૦/- પ્રતિ સ્લિપ
સ્વેપ પેમેન્ટ સિંગલ ચેક	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
સ્વેપ પેમેન્ટ સિરીઝ	૨૫ રોકડની સિરીઝ માટે રૂ. ૧૫૦
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫/- પ્રતિ ચેક
ટેક્નિકલ કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય

નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	ર ચેક સુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી
ટેક્નિકલ કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય
સ્થાયી સૂચનાઓ સેટઅપ / સુધારો (RD / SIP / બિલ ચુકવણી માટે મફત)	રૂ. ૨૫/- પ્રતિ વખત
સ્થાયી સૂચનાઓ બિષ્ફળતા (રીઝર્વ)	પ્રતિ ટિર્કો રૂ. ૧૫૦/-
નાણાકીય કારણોસર ECS ટિર્કો	પ્રતિ ટિર્કો રૂ. ૨૦૦/-
SMS ચેતવણીઓ (કેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	પ્રતિ મહિને ૧૦ મફત SMS. ત્યારબાદ, પ્રતિ SMS ૩૦ પૈસા
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ [^]	૩.૫%
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
બેલેન્સ પ્રમાણપત્ર શાખા (ઓનલાઇન મફત)	રૂ. ૨૫૦/- પ્રતિ વખત
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ઓનલાઇન મફત)	દર વર્ષે ૧ મફત, ૧ થી વધુ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦/-
પાસબુક જારી કરવી	મફત
ડ્રુપ્સિફેટ TDS પ્રમાણપત્ર	પ્રતિ વખત રૂ. ૫૦/-
ડ્રુપ્સિફેટ એક્સાઉટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	રૂ. ૧૦૦
ડ્રુપ્સિફેટ એક્સાઉટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	રૂ. ૫૦
DD/PO પુનઃમાનવીકરણ/રદીકરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ કરતા પહેલા ગ્રાહકની વિનંતી પર બંધ કરવામાં આવે તો ખાતું બંધ કરવાના શુલ્ક	રૂ. ૫૦૦
ખાતું બિષ્ફળ રહેવા પર શુલ્ક	શૂન્ય
ડેરસ્ટેપ બેંકિંગ ^{##}	
ચેક પિકઅપ	પ્રતિ વખત રૂ. ૫૦/-
કેશ પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦
૫,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
કોલ પર કેશ પિકઅપ (દરેક વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦/-
૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	રૂ. ૩૦૦/-
૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦/-
૧૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦	રૂ. ૮૦૦/-
રૂ. ૨૦૦,૦૦૦ સુધી	શાખાનો સંપર્ક કરો

^{*} લાગુ પડતા કા વધારાના રહેશે. PAP= પેપેનલ એટપાર NA: લાગુ પડતું નથી SA: સેવિંગ્સ એક્સાઉટ

નાણાકીય વ્યવહાર તરીકે ગણવામાં આવતા અપૂરતા ભંડોળને કારણે ચેક્ક ઉપાડ બિષ્ફળ

^{*}ELIT ઊંચે બેંકિટ કર્ડ ELIT ઊંચે ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક પાસે હવે ELIT ઊંચે પ્રોગ્રામ સ્ટેટ્સ ન હોય તો ૬૦૦ રૂપિયા શુલ્ક લાગુ પડશે (શુલ્ક ટાળવા માટે રિ-લેસમેન્ટ ડેબિટ કર્ડ માટે ફેરબર ફેર/શાખાનો સંપર્ક કરો)

^{##}સેવાઓ ફક્ત પસંદગીની શાખાઓ પર જ ઉપલબ્ધ છે. ભારતમાં; ન્યૂનતમ મૂલ્ય રૂ. ૫૦,૦૦૦; અને મહત્તમ મૂલ્ય રૂ. ૨,૦૦,૦૦૦

[^]ભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કા) વસૂલવામાં આવશે. આ ઇઅજબ ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે ઊદ્યોગિક (માસ્ટર્કાર્ડ વર્લ્ડ) અને ગણુજા (વિઝા પ્લેટિનમ). કૃપા કરીને નોંધ લો કે બેંકની વિવેકબુલેના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.